

ત્વરિત જાહેરાત માટે

બ્રમ્પટનમાં 2019 નિવેશ મિશનોની શુભ શરૂઆત

બ્રમ્પટન, ઓન્ટારિયો (19 સપ્ટેમ્બર 2019) – મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown) અને કાઉન્સિલરો બ્રમ્પટન ફોરિન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) મિશનનો પ્રારંભ કરતા રોમાંચની લાગણી અનુભવે છે. આવતા અઠવાડિયે મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown), ચુંટાયેલ અધિકારીઓ અને આર્થિક વિકાસના કર્મચારીગણ સપ્ટેમ્બર 22-25 વચ્ચે બોસ્ટનમાં થનાર મેડટેક (MedTech) કોન્ફરન્સમાં ભાગ લેશે.

આ વર્ષનાં પૂર્વાર્ધમાં કાઉન્સિલે \$1.875 મિલિયનના અંદાજપત્રને બહાલી આપી હતી જેથી બ્રમ્પટનની FDI વ્યુહરચના અને કાર્ય યોજનાનો અમલ કરી શકાય. FDI વ્યુહરચના [ઇકોનોમિક ડેવેલપમેન્ટ માસ્ટર પ્લાન \(EDMP\)](#) અને [2040 વિઝન](#)નાં લક્ષ્યો પરિપૂર્ણ કરશે, ખાસ કરીને નવું નિવેશ અને નોકરીઓ આકર્ષી શકશે, સખાય ચેઈનમાં રહેલ ત્રુટીઓ દૂર કરશે, ટેક્સ બેઝને વ્યાપક બનાવશે અને આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરશે. આ કાર્યક્રમનો હેતુ શહેરની પ્રોફાઈલને એક સ્પર્ધાત્મક સ્થળ પુરવાર કરવાનો પણ છે જ્યાં વ્યાપાર કરી શકાય અને શહેરમાં FDI ખેંચી લાવવા માટે મદદરૂપ થતી પ્રવૃત્તિઓ શરૂ કરી શકાય.

બ્રમ્પટનનાં FDI અંગેના પ્રયાસો સિટીના મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો પર કેન્દ્રિત છે: હેલ્થ અને લાઈફ સાયન્સિસ, એડવાન્સડ મેન્યુફેક્ચરિંગ (ખોરાક અને પીણા ઉત્પાદન સહિત), અને ઇનોવેશન તથા ટેકનોલોજી. મેડટેક (MedTech) કોન્ફરન્સ આરોગ્ય અને જૈવિક વિજ્ઞાનના ક્ષેત્રમાં બ્રમ્પટન માટે બરાબર બંધ બેસતી છે અને ટ્રેડ શોની બેઠકો અને પ્રવૃત્તિઓ મેડટેક કેનેડા (Medtech Canada)નાં સહયોગથી વિકસાવવામાં આવી છે.

મેડટેક કેનેડા (Medtech Canada) તે કેનેડાનું તબીબી ટેકનોલોજી માટેનું ઔદ્યોગિક સંગઠન છે જે હેલ્થકેરને ડિજિટાઈઝ કરવામાં ફાળો આપી રહ્યું છે અને વધુ સંકળાયેલ સંભાળ પૂરી પાડે છે તેમજ સમુદાયોમાં દર્દી કેન્દ્રી સંભાળ વધુ મળે તેવી તકો પૂરી પાડે છે.

આ વર્ષે આયોજીત અન્ય અભિયાનોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

- અનુગા ફૂડ ફેર, કોલોન, જર્મની
- વેબ સમીટ, લિસ્બન, પોર્ચુગલ

વધુ જાણકારી માટે અહીં મુલાકાત લો www.investbrampton.ca

અવતરણો

"આપણા FDI મિશનને શરૂ કરતા તેમજ વિશ્વ ફરતેનાં વ્યાપારિક અગ્રણીઓને મળીને મને રોમાંચનો અનુભવ થાય છે. FDI શહેરના ભવિષ્ય માટેનું આ રોકાણ છે. અમારે ટોચનાં ઉદ્યોગોને જાણાવવું છે કે જ્યારે તેઓ વિકાસ સાધવા, વિસ્તરણ કરવા અને નિવેશ કરવા બ્રેમ્પટન પર પસંદગી ઉતારે ત્યારે તેઓને અત્યંત કુશળ પ્રતિભાઓ, સ્પર્ધાત્મક ફાયદા અને વૈશ્વિક માર્કેટપ્લેસની સુગમતા મળી શકશે."

- મેયર પેટ્રિક બ્રાઉન (*Mayor Patrick Brown*)

"વસ્તીનાં અપેક્ષિત વધારાને પહોંચી વળવા અને તેને ટેકો આપી શકે એવા આર્થિક વિકાસને વેગ આપવા તે બ્રેમ્પટન માટે અતિશય અગત્યનું છે કે તે પોતાની પ્રોફાઇલ વૈશ્વિક બજારોમાં મજબૂત બનાવે. મજબૂત વૈશ્વિક સાંખ આપણને વેપાર, વિદેશી નિવેશ અને રોજગાર આકર્ષવામાં મદદરૂપ થશે."

- રીજનલ કાઉન્સિલર ગુરપ્રીત એસ ધિલ્લોન, ઈકોનોમિક ડેવેલપમેન્ટના પ્રમુખ

"FDIની તકો સફળતાપૂર્વક મેળવવા માટે સંભવિત નિવેશકારો સાથે સંબંધ બાંધવા અતિશય મહત્વપૂર્ણ છે. આવા મિશન પરિચય કરાવવા અને મહત્વપૂર્ણ વૈશ્વિક વ્યાપારિક અગ્રણીઓ સાથે આપણા સંબંધો વધારવા માટે અનિવાર્ય છે."

- ક્લેર બાર્નેટ, ડાયરેક્ટર, બ્રેમ્પટન ઈકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca